

ત્વરિત જાહેરાત માટે

## સીટી ઓફ બ્રમ્પટન ત્રીજા વાર્ષિક બેક્યાર્ડ ગાર્ડન પ્રોગ્રામનું લોકાર્પણ કરશે ફેબ્રુઆરી 2ના દિને

બ્રમ્પટન, ઓન્ટારિયો (02 ફેબ્રુઆરી 2022) – આજે સીટી ઓફ બ્રમ્પટનનો સફળ બેક્યાર્ડ ગાર્ડન પ્રોગ્રામ ત્રીજા વર્ષે ફરી હાથ ધરાશે. સહભાગીઓને નિઃશુલ્ક માટી, બિયારણ અને પોતાનો બેક્યાર્ડ ગાર્ડન વિકસાવવાના સૂચનો આપીને આ પર્યાવરણ સાથે મૈત્રિપૂર્ણ પહેલ આપણા શહેરની ખોરાકી સુરક્ષાને સમર્થન આપવામાં મદદરૂપ થશે.

બેક્યાર્ડ ગાર્ડન પ્રોગ્રામ નિવાસીઓને ઝાડપાન વાવીને પોતાના ઘરમાં પાકેલ ઉપજને સ્થાનિક ફૂડ બેંક અને સામાજિક સંસ્થાઓને દાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

નિઃશુલ્ક બિયારણ અને માટી મેળવવા માટે આજે ફેબ્રુઆરી 2ના રોજથી નિવાસીઓ ઓનલાઇન રજિસ્ટર અહીં કરાવી

શકશે [www.brampton.ca/backyardgarden](http://www.brampton.ca/backyardgarden). વેબ પેજ પર આ વર્ષના બેક્યાર્ડ ગાર્ડનોના ફોટા, બાગકામના સૂચનો, ટુટોરિયલો અને સંસાધનો પણ ઉપલબ્ધ થશે. સોશયલ મિડિયા પર પોતાના બેક્યાર્ડ ગાર્ડનને શેર કરવા નિવાસીઓ હેશટેગ #BramptonBackyardGarden નો ઉપયોગ કરી શકશે.

આ પ્રોગ્રામથી મેચરના COVID-19 સોશયલ સપોર્ટ ટાસ્ક ફોર્સ ના ખોરાકી સુરક્ષા પરના ફોકસને સમર્થન મળશે, સિટીની ટકાઉ ગ્રીન સિટી અંગેની પ્રાથમિકતાને બળ મળે છે અને રહેવાસીઓની શારીરિક અને માનસિક સુખાકારીને વેગ મળશે.

આ વર્ષે પ્રોગ્રામનું પ્રાયોજન કરવાનું ગૌરવ સ્કોટ્સ કેનેડા લિમિટેડને મળ્યું છે. સિટી તેમના પ્રોગ્રામના સમર્થકોનો આભાર માને છે જેમાં સામેલ છે મટામી હોમ્સ (Mattamy Homes), પેરેડાઈઝ ડેવેલપમેન્ટ્સ (Paradise Developments), ફિલ્ડગેટ ડેવેલપમેન્ટ્સ (Fieldgate Developments) અને TACC હોલબોર્ન કોર્પોરેશન (Holborn Corporation).

કોઈ પ્રશ્નો છે? ઈમેઇલ [BramptonGreenCity@brampton.ca](mailto:BramptonGreenCity@brampton.ca).

### બેક્યાર્ડ ગાર્ડન ક્લબ ઈ-ન્યુઝલેટર

બ્રમ્પટન લોકલિટીવરલ સોસાયટી અને ચિંગકુઝી ગાર્ડન ક્લબ સાથેની ભાગીદારીમાં આવનાર આપણા માસિક બેક્યાર્ડ ગાર્ડન ક્લબ ઈ-ન્યુઝલેટરમાં જોડાઓ. તમામ બાગકામ કરતા રસિકો માટે ખુલ્લુ હોવાથી સભ્યો બાગકામને લગતી માહિતી સાથેનું માસિક ઈ-ન્યુઝલેટર પ્રાપ્ત કરશે, પ્રશ્નો મોકલવાની તક સાંપડશે, વિશેષજ્ઞો અને સમુદાયના ભાગીદારો પાસેથી બાગકામ અંગેની સલાહ અને ટેકો મળશે તેમજ અનોખી રજૂઆતો અને બીજું ઘણું બધું મળી શકશે.

ક્લબમાં રજીસ્ટર થવા માટે અહીં મુલાકાત લો [www.brampton.ca/backyardgarden](http://www.brampton.ca/backyardgarden).

## પૃષ્ઠભૂ

સિટીના બીજા વાર્ષિક બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ દરમિયાન એપ્રિલથી ઓક્ટોબર 2021 દરમિયાન સ્થાનિક ફૂડ બેંકો અને સામુદાયિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ રહેવાસીઓને લગભગ 7,000 lbs (પાઉંડ) પેદાશોનું દાન કરવામાં આવ્યું હતું.

બ્રેમ્પટનના બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામની શરૂઆત એપ્રિલ 2020 માં, પ્રથમ વખત કેનેડામાં COVID-19ના જવાબરૂપે થઈ. તે સિટીના પ્રવર્તમાન કમ્યુનિટી ગાર્ડન્સ પ્રોગ્રામનો જ વિસ્તારિત ભાગ છે.

## સુવાક્યો

"અમને બ્રેમ્પટનમાં ત્રીજા વાર્ષિક બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામનું લોકાર્પણ કરતા ગૌરવની લાગણી થાય છે. ગત બે વર્ષથી આ પ્રોગ્રામ દ્વારા બાગકામ મારફતે આપણા સમાજને એક બીજાથી નજીક લાવી શકાયો છે, જરૂરિયાતમંદ લોકોને માટે ખોરાકી સુરક્ષા પ્રદાન થઈ શકી છે અને સહભાગીઓ ઘરની બહાર સક્રિય રહી શક્યા છે. માટી અને બિયારણ મેળવવા માટે હું નવા સહભાગીઓને પ્રોત્સાહિત કરું છું જેથી આ વર્ષે પણ આપણે સમાજને કંઈક પાછું આપી શકીએ.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બે વર્ષથી બ્રેમ્પટનનો બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ જોરદાર રીતે સફળ રહ્યો છે અને ત્રીજા વર્ષે ફરી આ પ્રોગ્રામની શરૂઆત કરતા હું રોમાંચિત છું. ગત વર્ષે અમે લગભગ 7,000 પાઉંડ જેટલી પેદાશો જરૂરિયાતમંદ રહેવાસીઓને બ્રેમ્પટનમાં સ્થિત ફૂડ બેંક અને સામાજિક સંસ્થાઓ મારફતે પહોંચાડી શક્યા હતાં. બ્રેમ્પટનવાસીઓ ચાલો આપણે બાગકામ કરી કંઈક પાછું આપીએ!"

- ડુગ વ્હિલાન્સ, સિટી કાઉન્સિલર, વોર્ડ 2 અને 6, પ્રમુખ, બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ, સીટી ઓફ બ્રેમ્પટન

"સિટીના કર્મચારીગણ આ વર્ષે બેકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામને સમર્થન આપવા આતુર છે. સિટી તેમના પ્રાયોજકો અને સમર્થકોને નવાજીને તેમનો આભાર માને છે જેઓની મદદથી આ મહત્વપૂર્ણ હરિત પહેલ શરૂ થઈ શકી છે. આજે જ નિ:શુલ્ક બિયારણ અને માટી માટે અહીં રજીસ્ટર કરો [www.brampton.ca/backyardgarden](http://www.brampton.ca/backyardgarden)."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)